

અરજી નંબર :-

ધિરાણ મેળવવા માટેનું અરજી પત્રક

(તબદીલને પાત્ર નથી)
વિના મૂલ્યે



રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હી (એન.એસ.એફ.ડી.સી.)

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન

બ્લોક નં. ૧૦, બીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

યોજનાનું નામ :- પશુપાલનની યોજના

તાજેતરનો
પાસપોર્ટ
સાઈઝનો ફોટો
(અરજદારે ફોટા
ઉપર સહી કરવી.)

આધાર નંબર :-

અરજદારની વિગત :-

- (૧) પુરેપુરું નામ :-
- (૨) સરનામું :-
- (૩) જન્મ તારીખ :- ઉંમર (જાહેરાતની તારીખે)
- (૪) કુટુંબના સભ્યોની સંખ્યા :- તે પૈકી કમાતા સભ્યોની સંખ્યા :-
- (૫) કુટુંબના સભ્યોની વાર્ષિક આવક રૂા.
 - (અ) ઉદ્યોગ ધંધામાંથી :- રૂા. (બ) જમીન ખેતીમાંથી :- રૂા.
 - (ક) નોકરીમાંથી :- રૂા. (ડ) છુટક મજુરી/ અન્ય વિ. :- રૂા.
- કુલ આવક :- રૂા.
- (૬) અરજદારની જાતિ તથા પેટા જાતિ (સક્ષમ અધિકારીશ્રીના દાખલાની પ્રમાણિત નકલ સામેલ કરવી)
- (૭) શૈક્ષણિક લાયકાત :-
- (૮) બી.પી.એલ. યાદી નં. :-
- (૯) વિધવા/ ત્યકતા/ વિકલાંગ હોય તો તેની વિગત
- (૧૦) અરજદારે કે તેઓના કુટુંબના અન્ય સભ્યએ અગાઉ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની યોજનાઓ કે અન્ય સરકારી એજન્સી મારફત લોન / સહાય મેળવેલ છે કે કેમ ? તેની વિગતો આપવી.
.....
- (૧૧) અ. ધંધાને અનુરૂપ કરેલ કોર્સ / તાલીમ ની વિગત.
 - (૧)
 - બ. ધંધાને અનુરૂપ અનુભવની વિગત.
 - (૧)
 - (૨)
 - ક. ધંધા લોનની જરૂરીયાત. (સાધન- સામગ્રી, સરંજામ તથા કાર્યકારી મૂડી ની વિગતો એક અલગ પેપર ઉપર દર્શાવી અરજી સાથે સામેલ રાખવી.)
 - (૧) સાધન સામગ્રી - સરંજામ માટે રૂા.
 - (૨) કાર્યકારી મૂડી માટે રૂા.
 - કુલ રૂા.
- (૧૨) (અ) ધંધાને અનુરૂપ જગ્યા ધરાવો છો કે કેમ ? હા / ના જો હા, તો તેની વિગત
(બ) લોન મળ્યા બાદ ધંધાના આયોજન તથા માર્કેટીંગની વિગત :-
- (૧૩) સ્થાવર મિલકત ધરાવો છો કે કેમ ? હા / ના હા તો અંદાજીત રકમ રૂા.
- (૧૪) ટેલીફોન નંબર (એસ.ટી.ડી. કોડ સાથે) મોબાઈલ નંબર :-
- (૧૫) બેન્ક ખાતાની વિગત :- (અ) બેન્કનું નામ :- (બ) શાખાનું નામ :-
(ક) ખાતાનો નંબર :- (ડ) ખાતાનો પ્રકાર :- બચત ખાતું/ ચાલુ ખાતું

સાક્ષીની સહી :-

નામ :-

સરનામું :-

અરજદારની સહી :-

નામ :-

બાંહેધરી પત્રક

૧. આથી હું પ્રમાણિત કરુ છું કે, અરજીના નમૂનામાં જે કોઈ વિગતો દાખલા આપેલ છે, તે મારી જાણ પ્રમાણે તદ્દન સાચી છે. તેમાં પાછળથી કોઈપણ વિગત સાચી ન હોવાનું સાબિત થાય તો મળેલ લોનની રકમ એક સાથે ભરપાઈ કરવા બંધાઉં છું અને તે બદલ ખાત્રી આપું છું.
૨. લોન લેવા માટે એન.એસ.એફ.ડી.સી., નવી દિલ્હી અને ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર તરફથી જે કંઈ શરતો બોલીઓ નક્કી થશે તે પ્રમાણે વર્તવા આથી હું બાંહેધરી આપું છું.
૩. આ અગાઉ મેં કે મારા કુટુંબની અન્ય કોઈ વ્યક્તિએ નિગમ/ કોઈપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેન્ક પાસેથી વાહન ખરીદવા અથવા અન્ય ધંધા માટે કોઈપણ પ્રકારનું ધિરાણ મેળવેલ નથી કે માંગણી કરેલ નથી તે બદલ ખાત્રી આપું છું. જેમાં કંઈ પણ કસૂર થશે તો નિગમ કાયદેસર કાર્યવાહી કરવા કુલ મુખત્યાર છે. ધિરાણ મળેથી નિયમિત હપ્તા ભરવા, તે દરમ્યાન નિગમને મારું વાહન / સાધનો હાઈપોથીકેશનમાં રાખવા અને નાણાં સમયસર ન ભરવા માટે રેવન્યુ રાહે વસુલાત લેવા અને દંડનીય વ્યાજ સાથે ભરપાઈ કરવા બંધાઉં છું તે માટે હું તેમજ મારા વંશ વારસો જવાબદાર રહેશે તે હું પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું.
૪. અરજી પત્રકમાં ભરેલ તમામ વિગતો સાચી છે. પસંદગી થયા બાદ કોઈપણ તબક્કે મેં અરજી પત્રકમાં આપેલ વિગતો ખોટી જણાશે તો હું ધિરાણ મેળવવા હકદાર રહીશ નહીં જેની હું બાંહેધરી આપુ છું.

અરજદારની સહી :-

નામ :-

સરનામું :-

ધિરાણ મેળવવા અંગે સુચનાઓ અને શરતો

૧. આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિની અને ગુજરાત રાજ્યના વતની હોય તે લોકોને જ આપવામાં આવશે.
૨. અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૨૧ વર્ષથી નીચે અને ૫૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
૩. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારોમાં રૂ. ૮૮,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- થી વધુ હોવી જોઈએ નહીં.
૪. લોન પરત ભરપાઈ કરવા માટે અંગત જામીનગીરી ખત આપવાના રહેશે. તથા યોજનાના નિયમો મુજબ માંગણી થયેથી વસુલાત પેટે ચેક આપવાના રહેશે.
૫. નિગમની લોનથી ખરીદેલ વ્હીકલ / સાધનોનું નિગમની તરફેણમાં હાઈપોથીકેશન કરી આપવાનું રહેશે તથા નિગમ તરફથી નકકી કરેલ બાંહેધરી / જામીનખત વગેરે ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
૬. જ્યાં સુધી લોનની રકમ વ્યાજ સહિત પુરેપુરી ભરપાઈ ન થાય ત્યાં સુધી અરજદાર વ્હીકલ / સાધનો અન્ય વ્યક્તિને વેચી શકશે નહીં કે ગીરો મૂકી શકશે નહીં કે અન્યને તબદીલ કરી શકશે નહીં.
૭. નિગમ તરફથી ધિરાણ કરવામાં આવેલ રકમ ઉપર નિયત દરે વ્યાજ લેવામાં આવશે. તથા નિગમ નકકી કરે તે પ્રમાણે લોન હપ્તા દર માસે નિગમની જીલ્લા કચેરીમાં જમા કરાવવાના રહેશે. જો સમયસર હપ્તા નહીં ભરવામાં આવે તો નિગમ નકકી કરે તે મુજબ દંડનીય વ્યાજ લેવામાં આવશે.
૮. ડયુ થયેલ હપ્તા ભરવામાં નહીં આવે તો ડીફોલ્ટર પાસેથી નિગમ તરફથી વધારાનો જે વ્યાજનો દર નકકી થાય તે પ્રમાણે દંડનીય વ્યાજ લેવામાં આવશે.
૯. ચડત થયેલ સળંગ ત્રણ હપ્તાઓ ભરવામાં નહીં આવે તો નિગમ તરફથી સાધનો પરત લઈ, તેની હરાજી કરી બાકીની રકમ અરસપરસ ધોરણે વસુલ લેવા નિગમ હકકદાર રહેશે.
૧૦. કોઈપણ એજન્સી / નિગમ / સંસ્થા પાસેથી અગાઉ લોન / સહાય લીધેલ હોય તો તેની વિગત આપવી. જો તેમાં ચૂક થશે તો અપાયેલ તમામ રકમ વ્યાજ સહિત એક સાથે વસુલ લેવામાં આવશે તથા અપાયેલ વાહન / સાધનો જપ્ત કરવામાં આવશે.
૧૧. કોઈપણ કારણસર લોન અરજી ફોર્મ ભર્યા બાદ નિર્ણય કરવા માટે કે નિર્ણય થયા બાદ લાભાર્થીને ફાળવવાના વાહન / સાધનો આપવામાં વિલંબ થશે તો તે માટે કોર્પોરેશન જવાબદાર રહેશે નહીં.
૧૨. આવેલ અરજીઓની સંખ્યા તથા તેની ગુણવત્તાને ધ્યાને લઈને અરજી મંજૂર કે નામંજૂર કરવાની સત્તા કોર્પોરેશનની રહેશે. આ અંગે કોઈપણ જાતની તકરાર કે કોર્ટ વિવાદ ચાલશે નહીં તથા કોઈ પત્ર વ્યવહાર કરવો નહીં.
૧૩. જામીનદારની માલિકીની ખેતીની જમીનના કિસ્સામાં જમીન બોજા મુક્ત હોવી જોઈએ અને ધિરાણ મેળવે નિગમની તરફેણમાં જમીન ગીરોખત કરી આપવાની રહેશે.
૧૪. અરજીમાં દર્શાવેલ તમામ વિગતોના આધારો પસંદગી થયા બાદ રજુ કરવાના રહેશે. જો આધારો રજુ કરવામાં નહીં આવે તો પસંદગી રદ થશે અને ધિરાણ મેળવવા હકદાર રહેશે નહીં.
૧૫. નિગમ તરફથી અન્ય વિગતો બોલીઓ અને શરતો વખતો વખત નકકી થશે તે કબુલ મંજૂર રાખવાની રહેશે.

ઉપરના તમામ નિયમો / શરતો મેં ધ્યાન પૂર્વક વાંચ્યા છે અને તે વાંચી સમજીને તે મને તેમજ મારા વંશ વારસોને કબૂલ મંજૂર છે. તેવી કબૂલાત આપું છું.

સાક્ષીની સહી :—.....

અરજદારની સહી :—.....

નામ :—.....

નામ :—.....

સરનામું :—

તારીખ :—.....

અરજી ચકાસણી અંગેની વિગત
(ફક્ત કચેરીના ઉપયોગ માટે)

૧. લોન અરજી ફોર્મ સાથે રજુ થયેલ સાધનિક કાગળો અંગે સ્થળ ચકાસણી કર્યા બાદ નીચે મુજબનો અભિપ્રાય આપવો.

ક્રમ	વિગત	હા / ના
૧.	અરજદાર દર્શાવેલ સરનામે રહે છે ?	
૨.	અરજદારે અરજીમાં જણાવેલ વિગતો બરાબર છે ?	
૩.	અરજી ફોર્મ સાથે સામેલ દસ્તાવેજની ચકાસણી અસલ પ્રમાણપત્ર સાથે કરેલ છે તે બરાબર છે ?	
૪.	અરજદારે જાતિનો દાખલો તથા કુટુંબની વાર્ષિક આવકનો દાખલો સક્ષમ અધિકારીશ્રીનો જોડેલ છે ?	
૫.	ઘંઘાને અનુરૂપ કોર્સ / તાલીમ બાબતે અભિપ્રાય ૧ ૨	
૬.	દર્શાવેલ ઘંઘો તથા તેના સ્થળ મુજબ ઘંઘાની પોષણક્ષમતા બાબતે અભિપ્રાય	
૭.	અન્ય કોઈ વિગત હોય તો (જો હા હોય તો)	
૮.	લોન અરજી મંજૂર કરવા માટેનો સ્પષ્ટ અભિપ્રાય	

સ્થળ :- ચકાસણી કરનારની સહી :-

તારીખ :- નામ :-

હોદ્દો :-

(૨) અરજી ફોર્મના સાધનિક કાગળો તથા જીલ્લા કચેરીના રેકર્ડ મુજબ ચકાસણી બાદ અરજદારને ધિરાણ કરવા બાબતે જીલ્લા મેનેજરશ્રીનો જીલ્લા કક્ષાની કમિટીમાં ભલામણ કરવા બાબતે અભિપ્રાય

સ્થળ :- જીલ્લા મેનેજરની સહી :-

તારીખ :- નામ :-

(૩) જીલ્લા કક્ષાની પસંદગી સમિતિનો અરજી ભલામણ કરવા બાબતે અભિપ્રાય

સ્થળ :- જીલ્લા મેનેજરની સહી :-

તારીખ :- નામ :-

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન

ગાંધીનગર

જાહેરાત અન્વયેની યોજનાઓ થ્રી વ્હીલર(ઓટોરીક્ષા/લોડીંગ રીક્ષા), પશુપાલન અને

નાનાપાયાની યોજનામાં વિવિધ ધંધાઓમાં

મહત્તમ લોનની રકમની વિગત દર્શાવતુ પત્રક.

(જે તે યોજનામાં અથવા ધંધામાં મહત્તમ લોનની રકમ કરતા વધુ ખર્ચ થાય તો તે વધારાની રકમ

લાભાર્થીએ ભોગવવાની રહેશે અને તે અંગેનું સંમતિપત્ર આપવાનું રહેશે.)

ક્રમ	ધંધા / વ્યવસાય / યોજનાનું નામ		મહત્તમ લોનની રકમ રૂ.		
			કુલ ધિરાણ	લાભાર્થી ફળો	નિગમની લોન
૧	થ્રી વ્હીલરની યોજના (ઓટોરીક્ષા / લોડીંગ રીક્ષા)		રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૨	પશુપાલન		રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૩	નાના પાયાની યોજના				
	૧	કરીયાણાની દુકાન / પ્રોવિઝન સ્ટોર્સ	રૂ.૭૫,૦૦૦/-	રૂ.૭,૫૦૦/-	રૂ.૬૭,૫૦૦/-
	૨	રેડીમેડ કપડા/ગારમેન્ટ સ્ટોર્સ.	રૂ.૭૫,૦૦૦/-	રૂ.૭,૫૦૦/-	રૂ.૬૭,૫૦૦/-
	૩	મંડપ ડેકોરેશન	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
	૪	ઓટો રીપેરીંગ અને સાયકલ રીપેરીંગ	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
	૫	ટાયરપંચર	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
	૬	સેન્ટીંગ કામ	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
	૭	ટાઇલ્સ પોલીસીંગ	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
	૮	ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
	૯	મોબાઇલ રીપેરીંગ	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
	૧૦	ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનું રીપેરીંગ	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
	૧૧	હીરા ઉદ્યોગ (ડાયમંડ કટીંગ એન્ડ પોલીસીંગ)	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
	૧૨	કોમ્પ્યુટર જોબવર્ક	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
	૧૩	પશુ આહારનું વેચાણ	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
	૧૪	કોસ્મેટીકસની દુકાન	રૂ.૭૫,૦૦૦/-	રૂ.૭,૫૦૦/-	રૂ.૬૭,૫૦૦/-
	૧૫	દરજી કામ /એમ્બોડરી/ભરતકામ	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
	૧૬	ફોટો ફ્રેમ અને પ્લાસ્ટીક લેમીનેશન	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
	૧૭	આઇસ્ક્રીમ પાર્લર અને ઠંડાપીણા	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-

૧૮	કટલરી સ્ટોર	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૧૯	ફળ-ફળાદી અને શાકભાજીની દુકાન	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૨૦	મીઠાઈ ફરસાણની દુકાન	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૨૧	બ્યુટી પાર્લર	રૂ.૭૫,૦૦૦/-	રૂ.૭,૫૦૦/-	રૂ.૬૭,૫૦૦/-
૨૨	પોલ્ટ્રી ફાર્મ	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૨૩	કેટરર્સ	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૨૪	ગીફ્ટ આર્ટીકલ સ્ટોર્સ	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૨૫	સુથારી કામ	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૨૬	ચાર્મોદ્યોગ	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૨૭	વણાટકામ	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૨૮	ફેબ્રીકેશન/વેલ્ડીંગ કામ	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૨૯	પ્લામ્બરીંગ	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૩૦	પ્લાસ્ટીકના સાધનો વેચવાની દુકાન	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૩૧	મોચીકામ/બુટ-ચંપલની દુકાન	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૩૨	બેકરી	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૩૩	વાયરમેન	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૩૪	સાઉન્ડ સીસ્ટમ (ડી.જે.)	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૩૫	અગરબત્તી બનાવવી	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૩૬	મીણબત્તી બનાવવી	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૩૭	સીમેન્ટની આઇટમ બનાવવી	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૩૮	મીનરલ વોટર પ્લાન્ટ	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૩૯	લાઇટીંગ ડેકોરેશન	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૪૦	સાયબર કાફે	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૪૧	સ્કૂલ અને લગેજ બેગ બનાવી અને રીપેરીંગ કામ	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૪૨	ટી સ્ટોલ	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૪૩	અન્ય ધંધાઓ લાભાર્થી પસંદ કરે તે	નિગમ નક્કી કરે તે રકમ		